

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનના આર્થિક વિકાસની ક્યેરી (Brampton Economic Development Office) શહેરને રોકાણ કરવા માટેનું ઉત્કૃષ્ટ સ્થળ સ્થાપિત કરવાનું ચાલુ રાખે છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (22 એપ્રિલ 2022) – COVID-19 મહામારીમાંથી સાજા થઈને જ્યારે તેના દુષ્પ્રભાવમાંથી આગળ વધી રહ્યું છે ત્યારે બ્રેમ્પટનને રોકાણ કરવા માટેનું ઉત્કૃષ્ટ સ્થળ અને નવકલ્પનાના અગ્રણી તરીકે સ્થાપિત કરવામાં, સ્થાનિક પ્રતિભાઓનો વિકાસ કરવામાં અને સાહસિકોને સહયોગ આપવામાં બ્રેમ્પટનના આર્થિક વિકાસની ક્યેરી માર્ગ ઉજાગર કરવામાં અગ્રેસર રહ્યું છે.

આ [ટર્મ ઓફ કાઉન્સિલની પ્રાથમિકતાઓ](#)ની અગ્રિમતાઓના સમર્થનમાં જે પરિવર્તનક્ષમ પહેલો કાર્યરત છે અને પાયારૂપ સંબંધલક્ષી કર્મચારીગણ જેઓ તેનું ચાણતર કરી રહ્યા છે અને જાળવી રહ્યા છે તેનાથી સંપૂર્ણ સમુદાયો બનાવવામાં મદદ મળશે, અર્થતંત્રની સંભાવનાઓ ખુલ્લી થશે અને ઈનોવેશન કોરિડોરમાં બ્રેમ્પટનની અનન્ય સ્થિતિ દૃઢ બનશે.

મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ:

સપોર્ટ લોકલ

- મે 2020માં રહેવાસીઓ લોકલ એટલેકે સ્થાનિક ઉત્પાદો ખરીદે, ખાય, ઉપહાર તરીકે આપે અને સપોર્ટ કરે તે માટે આજે, સિટીએ તેમના ["સપોર્ટ લોકલ" અભિયાનની શરૂઆત](#) કરી.
- સપોર્ટ લોકલ અભિયાન સિટીના આર્થિક સુધારની વ્યુહરચનાની મહત્વપૂર્ણ પહેલ હતી, એક એવી યોજના જેનાથી COVID-19 મહામારીથી પ્રભાવિત વ્યવસાયોને મદદ કરીને શહેરના અર્થતંત્રને ફરી ધમધમતું કરી શકાય.

ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ:

- સિટી ઓફ બ્રેમ્પટન ઈનોવેશન અને ઉદ્યોગસાહસિક ઈકોસિસ્ટમ બનાવીને તેમના ડાઉનટાઉનની આર્થિક સંભાવનાને પુનર્જીવિત કરીને તેને ફરી ખુલ્લી કરવાનું ચાલુ રાખે છે: બ્રેમ્પટન ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ
- 2019થી કરાર બનવાના શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં [સિટીએ તેના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં \\$20.5 મિલિયન જેટલી માતબર રકમ રોકવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને તે ઉપરાંત ઈનોવેશન ભાગીદારો પાસેથી આશરે \\$55.2 મિલિયન જેટલું રોકાણ થઈ રહ્યું છે.](#)
- 2019 થી 2021ના સમયગાળામાં છ જેટલા નવા ભાગીદારો ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં પોતાની હાજરી નોંધાવી ચુક્યા છે. ઈનોવેશન ડિસ્ટ્રિક્ટના ભાગીદારોમાં સમાવેશ થાય છે બ્રેમ્પટન આંતરપ્રુન્યોર સેંટર, બીહાઈવ બ્રેમ્પટન (BHive Brampton), રાયેરસનની આગેવાનીમાં વન્યર ઝોન, અલ્ટિટ્યુડ એક્સેલરેટર, ફાઉન્ડર ઈન્સ્ટિટ્યુટ, અલગોમા યુનિવર્સિટી અને રોજર્સ સાયબરસિક્યોર

કેટેલિસ્ટ મુખ્ય મથક અને એક્સેલરેટર. શેરિડન એજ (Sheridan Edge), ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ ઊભું કરવા માટે બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડ અને ડાઉનટાઉન બ્રેમ્પટન BIA પણ મહત્વપૂર્ણ ભાગીદારો છે.

- માર્ચમાં, સિટી ઓફ બ્રેમ્પટનને ડિવલપર્સ અસોસિએશન ઓફ કેનેડા (EDAC) માર્કેટિંગ કેનેડા એવોર્ડ તેમના [ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ વિડિયો](#) માટે પ્રદાન કરવામાં આવ્યો હતો.

ડાઉનટાઉન બ્રેમ્પટન

- સિટીએ પોતાના ડાઉનટાઉનના વિકાસ માટે પગલાં લેવા ચાલુ રાખ્યા છે જેમાં સામેલ છે [12-મહિનાના વેલકમિંગ સ્ટ્રીટ્સ પાયલટ પ્રોગ્રામનું લોકાર્પણ](#). પ્રોગ્રામનો હેતુ ડાઉનટાઉન બ્રેમ્પટનમાં લોકો સુધી લક્ષ્યાંકિત આઉટરિચ સેવાઓ પહોંચાડવાનો છે, જેથી સ્થાનિક વ્યવસાયો અને રહેવાસીઓની જરૂરિયાતોને સંબોધી શકાય અને સલામતીમાં સુધારો લાવવામાં મદદ મળે.
- 2022માં, શહેરનો સ્ટાફ ડાઉનટાઉનના વ્યવસાયો અને રહેવાસીઓને સહાય કરવા અને ડાઉનટાઉનને પુનઃજીવિત કરવા માટે કાર્યક્રમો અને પહેલો પહોંચાડવાનું ચાલુ રાખવા માટે સિટીએ તેમનું ડાઉનટાઉન પ્રોજેક્ટ્સ સેન્ટર ખોલ્યું છે.

બ્રેમ્પટન આંત્રપ્રુન્યોર સેન્ટર:

- બ્રેમ્પટન આંત્રપ્રુન્યોર સેન્ટર કો-વર્કિંગ સ્પેસ 2019માં જ્યોર્જ સ્ટ્રીટ ખાતે ખોલવામાં આવ્યું ત્યારથી કર્મચારીગણ સ્થાનિક ઉદ્યોગસાહસિકોને સહાય કરવા સમર્પિત છે જેને પરિણામે આશરે 2000 નવા રોજગારનું સર્જન થઈ શક્યું છે.
- ટીમે 44,000 કરતા વધુ પૂછપરછોના જવાબ આપ્યા છે, 5,299 નાના વ્યવસાય સલાહમસલતો હાથ ધરી છે, 44,193 સહભાગીઓ માટે 2,851 સેમિનારોને અંજામ આપી શક્યા છે, 102 યુવા લોકોને કુલ \$3,06,000 ના સમર કંપની ગ્રાંટ જરી કરી શક્યા છે અને કુલ \$7,31,000 જેટલી રકમનું સ્ટાર્ટર કંપની ગ્રાંટનું ભંડોળ 175 વ્યવસાયો માટે જરી કરી શક્યા છે.
- 2021માં બ્રેમ્પટન આંત્રપ્રુન્યોર સેન્ટરે ઈમર્જન્સી મેનેજમેન્ટ ઓફિસ સાથે સહયોગ સાધ્યો હતો જેથી નાનાથી મધ્યમ કદના બ્રેમ્પટનના વ્યવસાયોને મફત COVID-19ની રેપિડ સ્ક્રીનિંગ કિટ્સ પૂરી પાડી શકાય.

પ્રત્યક્ષ વિદેશી રોકાણ (Foreign Direct Investment):

- ફોરિન ડાયરેક્ટ ઈનવેસ્ટમેન્ટ (FDI)ના કાઉન્સિલ દ્વારા મંજૂર થયેલ વ્યુહના ભાગરૂપે બ્રેમ્પટનના આર્થિક વિકાસની કચેરી (Brampton Economic Development Office) દ્વારા [InvestBrampton](#) અને 2019માં બ્રેમ્પટન મીન્સ બિઝનેસ નાઓ (Brampton Means Business Now) માટે FDI આકર્ષવા માટે બ્રાન્ડિંગ અને માર્કેટિંગના પ્રયાસોની શરૂઆત કરવામાં આવી.
- મેયર બ્રાઉન અને કાઉન્સિલના સભ્યો 10 કરતા વધુ આંતરરાષ્ટ્રીય મિશનો હાથ ધરી ચુક્યા છે જેના પરિણામે બ્રેમ્પટનમાં પાંચ નવા વ્યવસાયોએ પદાર્પણ કર્યું અને પાંચ બિઝનેસ રિટેન્શન અને વિસ્તરણ પરિયોજનાઓને ઓળખી શકાઈ છે.

- સીટી ઓફ બ્રેમ્પટન દ્વારા બીહાઇવ બ્રેમ્પટન (B Hive Brampton)નું લોકાર્પણ થયું, જે બ્રેમ્પટનના ઈનોવેશન ડિસ્ટ્રિક્ટમાં આંતરરાષ્ટ્રીય સાહસિકો માટે સોફ્ટ લેન્ડિંગ પેડનું કાર્ય કરશે. તેના લોકાર્પણથી અત્યાર સુધી 38 નવા વ્યવસાયો બીહાઇવ (Bhive)માં સ્વીકૃત થયા છે.

બિઝનેસ રિટેન્શન અને વિસ્તરણ:

- બ્રેમ્પટનના આર્થિક વિકાસની કચેરી (Brampton Economic Development Office)એ 2019 થી અત્યાર સુધીમાં આશરે 2,500 રોજગાર ઊભા કરવા અને જાળવી રાખવામાં સહાયતા કરી છે.
- જે 2,500 રોજગાર ઊભા કરવામાં આવ્યા અને જાળવવામાં આવ્યા તેમાં શહેરમાં રહેલી અમેઝોન (Amazon)ની હાજરીનો સમાવેશ થતો નથી જેનો વિકાસ COVID-19 મહામારી દરમિયાન થયો. અમેઝોનના પદચિહ્નમાં હવે બ્રેમ્પટન ખાતેની છ સવલતોનો સમાવેશ થાય છે જેમાં લગભગ 8,000 લોકોને રોજગાર મળ્યો છે.
- માર્ચમાં, સિટીએ જાહેર કર્યું કે [MDA એ બ્રેમ્પટનને તેના નવા હેતુ-નિર્મિત વૈશ્વિક હેડક્વાર્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સ ફોર સ્પેસ રોબોટિક્સ માટેના સ્થળ તરીકે પસંદ કર્યું.](#) નવી સ્ટેટ-ઓફ-દ-આર્ટ સવલતમાં હશે Canadarm3 અને 700 કરતા વધુ અતિ-કૌશલ્યવાન કર્મચારીઓ.

સિટીના આર્થિક વિકાસના પરિણામો વિશે વધુ માહિતી [અહીં](#) આપેલ રજૂઆતમાં મળી જશે. બ્રેમ્પટનના આર્થિક વિકાસની કચેરી (Brampton Economic Development Office) વિશે વધુ જાણકારી [અહીં](#) મળશે.

સુવાક્યો

“બ્રેમ્પટન એક આકર્ષક પરિવર્તનની મધ્યમાં છે, અને કાઉન્સિલની આ અવધિ દરમિયાન, અમે આપણા શહેરને એક મોટા ઈનોવેશન અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે વિકસાવ્યું છે, ભવિષ્યની કૌશલ્યવક્ષી નોકરીઓ ઊભી કરી છે અને પ્રખ્યાત વૈશ્વિક કંપનીઓને અહીં જ આપણા શહેરમાં જાળવી રાખી છે તેમજ તેને વિસ્તારવામાં સહાય કરી છે. બ્રેમ્પટન વ્યવસાયોને ગંભીરતાથી લે છે અને જ્યારે આપણા વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકો સફળ થાય છે ત્યારે આપણા આખા સમાજને લાભ મળે છે.”

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણે હવે COVID-19 મહામારીને બે વર્ષથી વધુ સમય સુધી સહન કરી ચુક્યા છીએ, અને આપણો વેપારી સમાજ તેનાથી અતિશય પ્રભાવિત થયો છે - પરંતુ બ્રેમ્પટન કાઉન્સિલ અને અમારી સમર્પિત આર્થિક વિકાસ ટીમે આપણા સ્થાનિક વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકો માટે લીધેલ દરેક પ્રયાસોમાં હાજરી આપી છે. આર્થિક સુધારની રણનીતિ પર ધ્યાન આપીને અમે બ્રેમ્પટનને રોકાણ કરવા માટેના ઉત્કૃષ્ટ સ્થળ તરીકે સ્થાપિત કરવાનું ચાલુ રાખ્યું છે અને તેથી આપણું શહેર મહામારીના પ્રભાવથી હવે દૂર જઈ રહ્યું છે.”

- *માર્ટિન મેડિરોસ (Martin Medeiros), રીજનલ કાઉન્સિલર, વોર્ડ 3 અને 4; પ્રમુખ, ઇકોનોમિક ડિવલપમેન્ટ, સીટી ઓફ બ્રેમ્પટન*

“ટર્મ ઓફ કાઉન્સિલની પ્રાથમિકતાઓને ધ્યાન પર લઈને તેના સમર્થનમાં જે પરિવર્તનક્ષમ પહેલો કાર્યરત છે તેનાથી સમુદાયોને પૂર્ણ બનાવવામાં મદદ મળશે, અર્થતંત્રની સંભાવનાઓ ખુલ્લી થશે અને ઈનોવેશન કોરિડોરમાં બ્રેમ્પટનની અનન્ય સ્થિતિ દૃઢ બનશે. બ્રેમ્પટન કાઉન્સિલ અને કર્મચારીગણ આપણા વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયો અને સમગ્ર સમુદાયને લાભ પહોંચાડવા માટે આપણા શહેરની આર્થિક ક્ષમતાને અનલોક કરવાનું ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે.”

- *પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; ઉપ પ્રમુખ, ઇકોનોમિક ડિવલપમેન્ટ, સીટી ઓફ બ્રેમ્પટન*

“સીટી ઓફ બ્રેમ્પટનના કર્મચારીઓ ટર્મ ઓફ કાઉન્સિલની પ્રાથમિકતાઓને ટેકો આપીને પરિણામો આપવા સમર્પિત છે: બ્રેમ્પટન અવસરોનું શહેર છે અને આમાં આપણા સમાજની આર્થિક સંભાવનાઓને બંધન મુક્ત કરવી તે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. અમારી ટીમે રોકાણ માટે બ્રેમ્પટનને ઉત્કૃષ્ટ સ્થળ તરીકે સ્થાપિત કરવા અને બ્રેમ્પટનને શિક્ષણ અને ઈનોવેશનના કેન્દ્ર તરીકે વિકસાવવા માટે અવિશ્વસનીય કાર્ય કર્યું છે અને અમારી આર્થિક રણનીતિથી તેઓ સારા પરિણામો આપીને આપણા શહેરને આગળ ધપાવવાનું ચાલુ રાખશે.”

- *પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન*

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca